


એકમ 2

ચેમિસ્ટ્રી

આત્માના
ફળ દ્વારા



મુશ્કેલ




મુશ્કેલ

મુશ્કેલ

વિદ્યાર્થી બુક


ચેમ્પિયન બનવા માટે...

...તમારે અને મારે આત્માના ફળ દ્વારા જીવવા માટે ભણવું જ જોઈએ, અને દૈનિક ધોરણે આપણા પાપ સામે લડવું જોઈએ. આ એક સરળ કાર્ય નથી, અને તેના માટે સમય, પરસેવો, તાલીમ અને પ્રયત્નોની જરૂર પડશે.




તમારા વર્કઆઉટ અને તાલીમ માટે દર અઠવાડિયે આ ક્લાસમાં આવો અને તમારા કોચને સાંભળો. સ્મૃતિ શ્લોક શીખો, બાઈબલની વાર્તા સાંભળો, અને તમારા હૃદયની અંદર ઝઝૂમી રહેલા પાપને કેવી રીતે હરાવવું તે શીખવામાં મદદ મેળવો..

પછી સપ્તાહ દરમિયાન, એ રીતે રીંગમાં પ્રવેશ કરો જાણે તમે તમારા વાસ્તવિક જીવનમાં દરેક પ્રકરણની પ્રેક્ટિસ કરો છો. દર વખતે જ્યારે તમે "ઈન ધ રિંગ (રિંગની અંદર)" હોમવર્ક અસાઈનમેન્ટ કરો છો, ત્યારે તમે પાપને એક મોટો મુક્કો મારી રહ્યાં છો!




લડાઈ ચાલુ રાખો, અને તમે સ્પર્ધાઓ જીતી જશો અને ચેમ્પિયન બની શકો છો!



ધીરજ વિ અધીરાઈ

બાઈબલની વાર્તા: સોનેરી વાછરડું
નિર્ગમન 32

મને લાગે છે કે હું આ સાથે
ત્યાં ઝડપથી પહોંચીશ.



વ્ય	મૂ	ચા	બ	ળ	ર્ય	મ	ત્કા	રો	ગુ	આ	ઈ
ઈ	ત	સા	કા	પ	ત	ત	સ	મૂ	લા	બ	ઝ
મ	ઝ	ત	આ	પ્ર	તી	ક્ષા	મ	આ	મી	વા	રા
ત્કા	નં	રા	ગ	શી	વા	દ	ય	મ	ત્કા	રો	યે
અ	સા	ભં	યે	નં	બ	ભ	અ	ન	ત	કા	ળ
દ	જ્ઞા	સ	ળ	લી	ચા	ર્ય	ગ	સા	પ	વ	ત
આ	શી	વા	દ	વ્યા	ઓ	પ્લે	પ્ર	વા	ક્ષા	વ્યા	લી
ઘૈ	ત	મૂ	ચા	ઘૈ	વ્યા	વ્ય	લા	ચા	ન	દ	આ
ર્ય	નં	બ	મ	ળ	ચા	ર	ક્ષ	ણ	આ	શી	વા


ઘૈર્ય
ઈઝરાયેલીઓ
બચાવ્યા
પ્લેગ
ગુલામી

રક્ષણ
મૂસા
પર્વત
આજ્ઞાભંગ
પ્રતીક્ષા

સમય
અનંતકાળ
ભગવાન
આશીર્વાદ
ચમત્કારો


મેમરી વર્ઝ :

" ઈશ્વરના મહિમાવંત સામર્થ્યથી
મળતી સર્વ તાક્ત વડે તમે બળવાન
થાઓ કે જેથી તમે સર્વ બાબતો
આનંદપૂર્વક ધીરજથી સહન કરી
શકો." કોલોસીઓને પત્ર 1:11



રીંગ માં

ભૂતકાળમાં ઈશ્વરે તમારા માટે જે કંઈક કર્યું છે તે ગંદકીમાં લખો, પછી તે સ્થળને ખડકથી ચિહ્નિત કરો. તે ચર્ચમાં કરો, દરેક વિદ્યાર્થી પોતાનું ખાસ સ્થળ બનાવશે, અને બીજું અઠવાડિયા દરમિયાન ઘરે કરશે. તમે તમારા સ્થળને ખડકથી ચિહ્નિત કર્યા પછી, ભગવાને શું કર્યું તે બીજા કોઈની સાથે શેર કરો.





ધીરજ વિ. દુઃખ

બાઈબલની વાર્તા: જોબ ધીરજથી પીડાય છે
જોબ 1-2

કૃ	પી	દુઃ	જ	હુ	મ	લો	ક	રા	બ	ખ્રિ	સ્તી
યો	ડા	જો	ર	ધી	મ	ર	ઘ	ન્ય	જો	ણ	ખ
દો	ષા	રો	પ	ખો	ણ	લો	ખ	પ	દુઃ	ર	સ્વી
મિ	રિ	કવ	રા	ત	સ	ધી	ક	કવ	ડા	ખ	કૃ
ત્રો	બ	જ	પ	ક્ષા	મ	રા	જો	યો	રા	દો	તિ
ણ	ર	દો	રિ	દ	ય	સ્તી	બ	કૃ	ખો	ષા	જ
ધી	યો	ણ	પ	ઘૈ	ર્ય	હુ	ન્ય	દ	સ્તી	રો	ધી
દુઃ	ડા	કૃ	કવ	જ	ર	ક્ષ	ણ	જો	બા	પ	કવ
જો	ધી	ણ	રા	સ્તી	યો	ખો	રિ	દુઃ	પા	ણ	ખ

ક્યારેક મને
અંદરથી રોતા
હોય તેવું લાગે
છે, તો પણ
હું સ્મિત કરી
શકું છું.



ઘૈર્ય
દુઃખ
પીડા
દુઃખ
ધીરજ રાખો

ઘન્ય
જોબ
હુમલો કર્યો
દોષારોપણ
પાપ


દબાણ
મિત્રો
પરિપક્વ
ખ્રિસ્તી
સ્વીકૃતિ

મેમરી વર્ઝ:
"તમારું શિક્ષણ મને નવું જીવન બક્ષે છે; મારી વિપત્તિમાં એ જ
મારું સાંત્વન છે." ગીતશાસ્ત્ર 119:50




રીંગ માં

જ્યાં ક્યાંય તમે સહન કર્યું હોય ત્યાં ભગવાનનો આભાર લખો. જોબની જેમ કહેવાનો પ્રયાસ કરો,
"ભગવાને આપ્યું અને ભગવાને લઈ લીધું. ભગવાનના નામની પ્રશંસા કરી શકાય છે." જો તમે કરી
શકો તો વર્ગમાં અન્ય લોકો સાથે શેર કરો.



ઘૈર્ય વિ ગર્વ

બાઈબલની વાર્તા: રાજા નેબુચેડનેઝર
ડેનિયલ 4



મેમરી વર્ક:

"કાર્યના આરંભ કરતાં તેનો અંત સારો અને અહંકારી
કરતાં ધીરજવાન સારો." સભાશિક્ષક 7:8

કે	ડિ	ટ	ઘૈ	ભ	ગ	વા	રો	પ્ર	જા	શં
રો	પ	સા	ર્ય	રો	ય	વ	ના	શ	સા	રો
પા	કા	રિ	શં	સ્વી	હં	ય	ર્	સા	કા	ણ
ફ	બ્ર	રો	પૂ	હે	ર	નો	જા	સ્વી	ર્ણ	સા
પ્ર	ક્ષ	ક્ષા	મ્	ર્ણ	પ્ર	પ્ર	તી	ક્ષા	હં	સ્વ
સા	દ	હુ	દ્ર્ય	ન	મ્ર	જા	શં	રો	રો	ય
કા	સ્વ	ટ	વા	સ્વી	ર્ણ	ર	શ	સા	જ	પ્ર
પ્ર	સ	ગ	ર્વ	સ	હુ	ન્ય	કા	હે	ન	શં
શં	ભ	કા	રો	હે	રિ	અ	હં	કા	ર	સ્વી
સ્વી	ય	સ્વ	ન્ય	દ	તી	રો	પૂ	સ	ર્ણ	રો

હું મારી જાતને નમ્ર કરવા
નથી માંગતો/માંગતી! શું
મારે ખરેખર થવું જોઈએ?



ગર્વ
પાપ
નાશ
રાજા
અહંકાર


શહેર
ભગવાન
નમ્ર
ઘૈર્ય
પ્રતીક્ષા

પરિપૂર્ણ
વચનો
સ્વીકારો
પ્રશંસા
ક્રેડિટ



રીંગ માં

પોતાને નમ્ર બનાવવા માટે કેટલીક પ્રવૃત્તિઓ કરો તમે કોઈ લાઈનમાં ઉભેલાને તમારું સ્થાન
આપી શકો છો, ટીવી શો જોવાનું ટાળી શકો છો જ્યાં પાત્રો ગૌરવથી ભરેલા હોય, સ્ટેજ પર
અથવા અન્યની સામે તમારું સ્થાન છોડી શકો છો, અથવા અન્યને સાચા ઠરવા દઈ શકો છો.



ઘૈર્ય વિ ગુસ્સો


બાઈબલની વાર્તા: ડેવિડ, નાબાલ અને એબીગેઈલ
1 સેમ્યુઅલ 25

લા	છુ	સ્તા	પી	ઈ	ખ્યા	જ	અં	ઘ	ટું	સ્વી	ક	શો	દ	ભ	ય	ક્ષ
ગ	પા	વો	ના	બા	લ	ન	કો	ન્ય	લો	ઉ	પા	ક્ષ	ર	પ્ર	ર	ના
ણી	વ	પ	ર	ઈ	ડા	ભો	ટું	વું	ભો	ન	ભી	સ્તા	ક્ષ	વા	સા	બા
વું	વું	કા	ગે	ન્ય	પ્ર	વા	સ	ક	ર્યો	જ	પ	શા	ણ	સ	ર્યો	ચું
ઓ	અં	બી	યો	બ	ક્ષ	ણ	ડા	લા	સ	ક	ન	ર	બા	ક	ડ	ર
મ	એ	છુ	ગ્ય	ન્ય	દ	ખો	છુ	ગ	ખો	ક	અ	સ	લ	વિ	ગે	ક્ષ
લો	ઘ	સ્તા	જી	વં	ત	લો	ત	ણ	ટું	જી	વં	ત	ડે	ર	લ	ણિ

મેમરી વર્ક:


“જો તમે ગુસ્સે થાઓ, તો તમારો ગુસ્સો તમને પાપમાં દોરી જાય એવું થવા ન દો; અને આખો દિવસ ગુસ્સે ન રહો.”
એફેસીઓને પત્ર 4:26

ક્રોધ
લાગણી
અંધ
ખોટું
સાચું
ડેવિડ
નાબાલ
એબીગેઈલ
બદલો
ભય
ભોજન
પ્રવાસ કર્યો
રક્ષણ
યોગ્ય
ધન્ય




રીંગ માં

ભેટ તરીકે આપવા માટે કેટલીક નાની વસ્તુઓ ખરીદો. જ્યારે પણ તમે ગુસ્સે થાઓ છો, ત્યારે તમે જે વ્યક્તિને ગુસ્સો કરો છો તેને એક વસ્તુ આપો. લોકોને નાની ભેટો આપીને તમારા ગુસ્સાને આરામ આપવાનો પ્રયાસ કરો, અને તમારી ધીરજને વધતી જુઓ.



ધીરજ વિ પાત્રતા

બાઈબલની વાર્તા: મત્રા અને ક્વેઈલ
એક્સોડસ 16:1-18



હું માનું
છું કે
હું આ
બ્લોબના
હાથ લઈ
શકે છે
તે બધાને
લાયક છું!

મેમરી વર્ઝઃ

"તમારે પણ ધીરજ રાખવી જોઈએ. પ્રભુના આગમનનો દિવસ નજીક છે, તેથી તમે ઉચ્ચ આશા રાખો. મારા ભાઈઓ, એકબીજાની વિરુદ્ધ ફરિયાદ ન કરો, જેથી પ્રભુ તમારો ન્યાય કરે નહિ. ન્યાયાધીશ ન્યાય કરવાને આવી પહોંચ્યો છે." યાકોબનો પત્ર 5:8-9


ભી	ખ	મા	ગ	વ	મ	લ્હા	રો	ટ	હ	ક	ર	દા	ક્તિ
ગ	ને	વિ	શ્વા	સ	ગ	ક	ડા	ભ	વા	મા	ર	ક	ભ
વ્ય	ક	ડા	શે	વ્ય	ને	બ	ટે	ર	પ્ર	ને	ક્ષ	ભી	ગ
ક્તિ	ટે	ટ	પ્ર	ષા	ડ	ક્તિ	ટું	ખ	લ્હા	છે	ણ	ખ	વા
ભ	ષા	મં	ખ	બ	ધિ	ભ	અં	ઘ	મં	ડી	ક્ત	માં	ને
ક	ગ	ભી	મ	લ્હા	રો	કા	રો	ન	ટું	યુ	હ	ગ	ધિ
ટે	ક્તિ	વા	ડ	હ	ક	દા	ર	પ્ર	ણી	ષા	ક્તિ	વી	દા
દૈ	ર્ય	વા	ન	ય	ટે	ટું	વ્ય	ગ	ડ	ય	મ	લ્હા	રો
ભી	હ	દા	લા	વ્ય	ધિ	ષા	મા	ક	ડા	ટ	ત્રા	મા	ગ

હકદાર
વ્યક્તિ
માને છે
લાયક

વિશેષાધિકાર
ઘમંડી
માગણીયુક્ત
ભીખ માંગવી


ભગવાન
ઘૈર્યવાન
વિશ્વાસ
મત્રા

બટેર
ચમત્કારો
બડબડાટ



રીંગ માં


આ અઠવાડિયે તમારે કોઈની પાસેથી કંઈ લેવાનું નથી. દર વખતે જ્યારે તમે કોઈ વસ્તુ માંગવા ઈચ્છો છો, ત્યારે પોતાને રોકો દરેક વખતે જ્યારે તમે તમારી જાતને ખોરાક, તરફેણ, સમય અથવા મદદ માંગવાથી સફળતાપૂર્વક રોકો છો; તમે આ પાપ સામે જીતી શકો છો.



દયા વિ. સરખામણી


બાઈબલની વાર્તા: રાજા શાઉલ અને ડેવિડ
1 સેમ્યુઅલ 18:5-16

મારું
મેગેઝિન
તમારા
મેગેઝિન
કરતાં વધુ સારું
છે. મને ખબર
છે!



મેમરી વર્ઝ:

"દરેકે પોતાની વર્તણૂકનો જાતે જ ન્યાય કરવો; કારણ, એમ કરવાથી તે પોતાની યોગ્યતાને આધારે ગર્વ કરી શકશે અને બીજાની સાથે સરખામણી કરવાની જરૂર રહેશે નહિ." ગલાતીઓને પત્ર 6:4



દં	વ	લો	હિ	ર્ષ્યા	બૂ	તુ	ર્ષ્યા	ડે	ધ	ન્ય
ક્ષ	ડ	કો	ણાં	ત્ય	લ	ઉ	પ્રા	વિ	મ	ણાં
સ	મા	ન	ક્ષ	ઈ	ર્ષ્યા	બું	વિ	ડ	દં	ડી
પ્રા	ડી	ના	ડી	ર્ષ્યા	ઉ	તા	ક્ષ	ઓ	પા	વિ
દ	છુ	પા	વ	ઓ	ન્ય	દ	હિ	મ	ણાં	ડ
યા	ત્ય	મ	લા	વું	તા	તુ	બૂ	લો	તા	ત્ય
ડે	ર્ષ્યા	હિ	લો	ક્ષ	શા	ઉ	લ	ડ	વ	ઓ
ક્ષ	મ	ડ	પ્રા	અ	ન્ય	બું	ઓ	ના	વું	ન્ય
ર્ષ્યા	ડી	મ	લ	યા	ડે	ક્ષ	લો	ણાં	ઓ	દં

દયા
અન્ય
લોકો
ક્ષમતાઓ


નાણાં
ઈર્ષ્યાબું
ડેવિડ
શાઉલ
મહિલાઓ

બૂમ પાડી
ઈર્ષ્યા
તુલનાઓ
વિવિધ
સમાન



રીંગ માં

અઠવાડિયાની શરૂઆતમાં પોતાને 20 નાના દડા આપો. દર વખતે જ્યારે તમે તમારી જાતને અન્ય લોકો સાથે સરખામણી કરો છો, ત્યારે એક દડો દૂર કરો. આમાં ફેસબુક અથવા અન્ય ઓનલાઈન એપ્લિકેશનો શામેલ છે જ્યાં આપણે ઘણીવાર પોતાને અન્ય લોકો સાથે સરખાવીએ છીએ. જો તમારે જરૂર હોય, તો આખા અઠવાડિયા માટે ફેસબુકથી દૂર રહો.




દયા વિ. કપટ

બાઈબલ વાર્તા: પીટર ખ્રિસ્તને નકારે છે
મેથ્યુ 26:31-35, 69-75


મેમરી વર્ક:

"હું જૂઠા માણસોની સાથે બેઠો નથી.

અને દંભીઓની સોબતમાં ભળ્યો નથી." ગીતશાસ્ત્ર 26:4



મને તપાસો! હું
મારા પોતાના
બળે ઊડું છું!



લડાઈ

પાપ

કપટ

છુપાવવું

સત્ય

પ્રામાણિકતા

દંભીઓ

ઉપદેશક

જીવંત

ઉપદેશો

પીટર

અસ્વીકાર

ઈસુ

ક્ષમા


પસ્તાવો

અ	સ્વી	કા	શો	પ્રા	ર	છુ	સ્તા	પી	ઈ	ધ્યા	છુ	ક	પ	ટ
લ	ઈ	દે	ક્ષ	મા	કા	પા	વો	ટ	ધ્યા	ઉ	સ્તા	પા	ઓ	વ
ક	પ	વ	સ્તા	ણિ	દં	ઉ	પ	ર	ઓ	ન્ય	કા	ભી	વ	ક
ઉ	પ	દે	શ	ક	ભી	વું	કા	ઓ	વું	તા	દં	પ	ક્ષ	વું
પ	સ્તા	ટ	ર	તા	ઈ	સ્વી	છુ	વું	લ	ડા	ઈ	ટ	ક્ષ	ઓ
વું	વો	દે	સ	ક	અ	ઉ	પ	દ	શ	છુ	પા	સુ	હિ	મ
પ્રા	મા	ણિ	ત્ય	સ	મા	ન	ક્ષ	જી	વં	ત	વ	વું	બૂ	લો



રીંગ માં

આ અઠવાડિયે, જેમને તમે ખોટું કહેવું હોય તેવા કોઈની પાસે જાઓ, અને તેમને સત્ય જણાવો. જૂઠ બોલવા બદલ માફી માંગો, અને તેમને માફ કરવા માટે કહો. દર વખતે જ્યારે તમે પાછા આવો છો અને સત્ય કહો છો ત્યારે આ પાપ સામે બીજી મોટી જીત હશે.



દયા વિ. અલિપ્તતા

બાઈબલની વાર્તા: રૂથ અને નાઓમી
રુથ 1:8-22

મેમરી વર્ડ્સ:


"કોઈને તારી મદદની જરૂર હોય અને તું એને મદદ કરી શકે તેમ હોય, તો તેને ના પાડીશ નહિ."
સુભાષિતસંગ્રહ 3:27

સ	સ્યા	અ	સં	લ	ગ્ન	કો	ન્ય	મ્મા	જો	કા	રુ	થ
સ	મા	ન	સં	વ	કા	દો	ડ	નિ	ડા	દો	સ્યા	ગ્ન
નિ	જ્ઞ	ળ	મ્મા	લ	દ	દ	તા	જ્ઞ	વું	નિ	દ	અ
ઈ	ર્થ	ળું	વિ	ણ	ગ્ન	પ્ત	જો	ડા	વૃ	દ	ડે	ધ
વૃ	કો	નું	સ	ડા	લિ	તા	દં	સ	મ	સ્યા	વિ	મ
ન્ય	દ	ડે	ધ	અ	ઈ	ર્થા	ળુ	મ્મા	અ	કા	ડ	દં
સ્યા	તિ	વિ	મ	ન્ય	ર્થા	ઉ	તા	ન	વું	તિ	થ	મ
વૃ	સ્યા	ડ	દં	મ	ના	ઓ	મી	પ	દે	શ	ક	દો

અલિપ્તતા
વલણ
અસંલગ્નતા
નિજ્ઞ
જોડાવું

કોનું
સમસ્યા
મદદ
અન્ય
કોડ

સમ્માન
વૃત્તિ
કાયદો
રુથ
નાઓમી




મને કોઈની મદદ કરવાની જરૂર નથી, કારણ કે જુઓ! મારી પાસે વાસ્તવિક આકાર પણ નથી! હું માત્ર એક બ્લોબ (પરપોટો) છું!



રીંગ માં

મદદ કરવા માટે કોઈને શોધો, ખાસ કરીને જો તેઓ "તમારી સમસ્યા નથી." શેરીમાં રહેલા બેઘર વ્યક્તિને, અથવા કદાચ શાળામાં નવી પેસિલ અથવા ઈરેઝરની જરૂરવાળા બાળકને આપો. ખાતરી કરો કે તેઓ તમારી સાથે સંબંધિત નથી, અને તમારી તેમને મદદ કરવાની જરૂર અથવા જવાબદારી નથી.





દયા વિ. દ્વેષ

બાઈબલની વાર્તા: એસ્થર તેણીના લોકોને બચાવે છે
એસ્થર 3-5

આઉચ! જ્યારે અન્ય લોકો
મારા પ્રત્યે મતલબી બને
ત્યારે દુઃખ થાય છે.

મેમરી વર્ક:

"મારા ભાઈઓ, તમારે વિષે મને પૂરી ખાતરી છે
કે તમે ભલાઈથી ભરેલા છો. તમે સર્વ જ્ઞાનથી
સંપન્ન છો. તમે એકબીજાને શીખવી શકો તેવા
છો." રોમનોને પત્ર 15:14



ટ્સ	સ્થ	દ્વે	નુ	ક	સા	ન	ઈ	પ્લો	પી
દ	પ્લો	ષ	ષી	ઉ	પ	દે	શ	ટ્સ	ટ
યા	દુઃ	ખ	ઓ	પ	વુ	વું	નુ	જ	ર
મ	ત	લ	બી	ઈ	પ	દ્વે	દ	ન	સ્થ
પ્લો	ઈ	જ	હૂ	આ	સ	સ	મા	રં	ભ
ક	જા	ન	ખ	ન	મ્મા	એ	સ્થ	ર	ન
ઓ	વું	દુઃ	દ્વે	ય	હૂ	દી	ઓ	પ્લો	વું
મા	સ્થ	નુ	પ્લો	પી	ઈ	ક	ન્ય	ભો	વ
દ્વે	બી	ર	અ	ટ	ર્ષ્યા	રુ	થ	જ	લ
ટ્સ	લ	સ્થ	ન્ય	ર	ઓ	હે	મો	ન	ણ

દયા
દ્વેષ
દુઃખ આપવું
ઈજા
નુકસાન


અન્ય
હેમોન
પ્લોટ્સ
મારવું
ચઢ્ઠીઓ

મતલબી
દ્વેષી
એસ્થર
ભોજન સમારંભ



રીંગ માં

આ અઠવાડિયે તેમના પ્રત્યે સ્વાર્થી બની રહેલા કોઈકને કોઈ કારણ વગર સુરક્ષિત કરો.
જ્યારે આપણે કોઈ બીજાનું રક્ષણ કરીએ છીએ, તેમ આપણે આપણા પોતાના હૃદયમાં આ
પાપ સામે લડીશું. કોઈ બીજાને બચાવવા માટે તમારી પોતાની પ્રતિષ્ઠાને જોખમમાં મૂકો.




દેવતા વિ. ઉદાસીનતા

બાઈબલની વાર્તા: સદોમ અને ગોમોરાહ
જુનેસિસ 18:16-33



મારે બીજા કોઈની ચિંતા કેમ કરવી જોઈએ? અહીં મારી પાસે મારી પોતાની મુશ્કેલીઓ છે!

ભલાઈ
ચિંતા
અન્ય
ઉદાસીનતા
અભાવ
જુસ્સો
ઉત્તેજના
ઈશ્વર
અબ્રાહમ
પરીઓ
નાશ
શહેરો
કરુણા
હૃદય




વ	ના	શ	મ	હ	ભ	અ	મ	ના	રી	ચિં	અ	ન્ય	જુ	સ્સ	ઈ
લ	દ	હે	દ	ક	ઉ	લા	બ્રા	દ	હે	તા	ભા	બ્રા	ડા	ઈ	શ્વ
ણ	ગ્ન	રો	શ્વ	રુ	ધ્યા	ડે	ઈ	હે	ન	હ	વ	ઉ	હ	શ્વ	ર
ક	જુ	સ્સો	ન	ણા	પ્રા	વિ	શ્વ	સી	મ	ન્ય	ભો	પ	ચિં	મ	અ
રુ	મ	હ	તા	જો	વિ	ડ	દા	જો	સ્સો	થ	જ	રી	હ	દ	ય
ણ	દ	ચિં	અ	ડા	રી	ઉ	તે	જ	ના	મો	ન	ઓ	શ્વ	ડા	જો

મેમરી વર્ડઃ
“હતાશ થયેલા માણસ પ્રત્યે તેના મિત્રે હમદર્દી દાખવવી જોઈએ, નહિ તો તે સર્વસમર્થના ભયનો ત્યાગ કરશે.”
યોબ 6:14



રીંગ માં


પ્રાર્થના કરો અને ભગવાનને આ અઠવાડિયે તમારા હૃદયમાં જુસ્સો વધારવાનું કહો. અન્ય લોકો માટે તમારી ઉત્કટતા વધારવા માટે તમે અન્ય લોકો માટે કરી શકો તેવું કંઈક તપાસો. કોઈ મંત્રાલયની મુલાકાત લો અને તેઓ શું કરી રહ્યા છે તે વિશે જાણો, અન્ય લોકોને ખવડાવતા આશ્રયસ્થાનમાં મદદ કરો અથવા સમગ્ર વિશ્વમાં જરૂરિયાતો વિશેના વિડિઓ જુઓ. જ્યાં તમે લઈ શકો ત્યાં ભાગ લો.



ભલાઈ વી. દુષ્ટતા

બાઈબલની વાર્તા: હેરોદ અને જહોન બાપ્ટિસ્ટ
લ્યુક 3:18-20, મેથ્યુ 14:1-12

મને ખ્યાલ ન હતો કે લોકો આટલા મતલબી હોઈ શકે. મને આ વજન હેઠળ બહાર નીકળવામાં થોડો સમય લાગી શકે છે.




ષ્ટ	હે	તૈ	વિ	દ્વે	નુ	ગ	સ્થ	દુ
હ	રો	ર	શ્વા	ષ	ષી	તૈ	ઓ	ષ્ટ
સ્ત	દ	ન્યા	સ	ભ	ગ	વા	ન	વિ
દ્વે	નુ	ય	ર	તૈ	લા	જહો	ર	શ્વ
ષ	ષી	બા	પ્તિ	સ્ત	વિ	ઈ	ક	ભો
તૈ	યા	ર	એ	સ્થ	ર	સો	શ્વા	જ
ભ	શ્વ	વા	ર્	જહો	ણ	શ્વ	સ્વ	ર્ગ
ઈ	ષ્ટ	સ્વ	ય	મા	બ	પ્તિ	સ્ત	જહો

ભલાઈ	ભગવાન	ઈશ્વર
દુષ્ટ	હેરોદ	સ્વર્ગ
હૃદય	જહોન	નરક
માણસો	બાપ્ટિસ્ટ	ન્યાય
વિશ્વાસ	તૈયાર	


મેમરી વર્ક:

"દુરાચાર તજો અને ભલાઈ કરો. લોકોનું કલ્યાણ શોધો અને તેની પાછળ લાગો."
ગીતશાસ્ત્ર 34:14



રીંગ માં

દુષ્ટતાની હાજરી જોવા માટે તમારી આસપાસ જુઓ, જ્યાં કોઈ વ્યક્તિ દેખીતી રીતે કોઈ કારણસર બીજાને દુખ પહોંચાડે છે. આ અઠવાડિયે નિર્દોષ વ્યક્તિને બચાવવા માટે દરમિયાનગીરી કરવાનો માર્ગ શોધો. કદાચ તેમને શાળામાંથી અલગ રસ્તે ઘરે જવામાં મદદ કરો, લંચ પૂરું પાડો, અથવા તેમની સાથે ચાલવામાં 4 નું જૂથ તમારી સાથે જોડો.




ભલાઈ વિ સ્વાર્થી મહત્વાકાંક્ષા

બાઈબલની વાર્તા: ટાવર ઓફ બેબલ
જુનેસિસ 11:1-9

ભલાઈ
સ્વાર્થી
મહત્વાકાંક્ષા
સત્તા
સમ્માન
સંપત્તિ
ભેદ
ખ્યાતિ
મથવું
પ્રાપ્ત
સાવચેત
ટાવર
બેબલ
નમ્ર

દ	મ્ર	ખ્યા	તિ	સ	થ	વું	સં	ઈ	ભે	પ્ત	ઈ	સ	પ્ત
સ	મ્મા	ન	સા	ક્ષા	ર	ક	પ	તિ	પ્રા	દ	સં	ટા	તા
ઈ	તિ	ર્થી	કાં	વ	પ્ત	રુ	ત્તિ	ય	હૂ	દી	ઓ	વ	દ
શ્વ	ઈ	ત્વા	ટા	ઈ	યે	ણા	ન	મ્ર	ઈ	હ	ખ્યા	સ્વા	ર્થી
ર	હ	સં	લા	ખ્યા	ક્ષા	ત	દ	લા	મ	હ	ના	કાં	ક્ષા
મ	થ	વું	બે	બ	લ	તિ	ભ	દ	ર્થી	ઉ	તે	જ	ના

હું ખૂબ અદ્ભુત છું! જ્યારે મારે કોઈ ઈચ્છા હોય, હું તે કરી લઉં છું!




મેમરી વર્ઝ:

"સ્વાર્થી મહત્વાકાંક્ષા અથવા મિથ્યાભિમાનથી કંઈ ન કરો; પણ એકબીજા પ્રત્યે નમ્રતા દાખવો અને પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણો."
ફિલિપીઓને પત્ર 2:3



રીંગ માં


તમારી ખ્યાતિ અથવા લોકપ્રિયતા વધારવા માટે આ અઠવાડિયે કંઈ કરશો નહીં. દર વખતે જ્યારે કોઈ તક ઊભી થાય છે, તેને ફેરવી દો. જેમ તમે આ કરો છો, તમે આ ખૂબ જ નીચ પાપને મુક્કો મારશો.



ભલાઈ વિ અશુદ્ધતા


બાઈબલની વાર્તા: જોસેફ અને પોટીફર
જુનેસિસ 39:1-21

શું હું આ નિસરણી ઉપર
ચડીને આ પરિસ્થિતિમાંથી
ભાગી શકું?



મેમરી વર્ઝ:

"એટલે જ અમે હંમેશાં તમારે માટે
પ્રાર્થના કરીએ છીએ કે, ઈશ્વરે તમને જે
જીવન જીવવાને માટે આમંત્રણ આપ્યું
છે તે જીવવાને તમે યોગ્ય થાઓ. તે
પોતાની શક્તિથી સારાં કમ કરવા માટે
તમારી સર્વ ઈચ્છાઓ પૂરી કરો અને
વિશ્વાસનું તમારું કાર્ય સંપૂર્ણ કરો."
થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 1:11



અશુદ્ધિ
દૂષિત
ક્રિયાઓ
નિર્દર્શન
હૃદય
જોસેફ
ગુલામી
પોટીફર
પત્ની
રોકાણ
શુદ્ધ
અંદર

ત્ની	રો	કા	ણ	ત્ની	દ્ધ	ફ	ર	બે	બ	લ	હ	અં	શુ
ફ	ય	ગુ	દૂ	ષિ	સે	દ્ધિ	અ	જો	પ	ત્ની	દ્ધિ	દ	ત્ની
ન	દ્ધિ	લા	પ	જો	ફ	હ	ષિ	શુ	સ	મ્મા	ન	ર	દ્ધ
શુ	દ્ધ	મી	ષિ	ઓ	નિ	દ	ર્શા	ન	દ્ધિ	દ્ધ	ફ	ય	ફ
હ	ફ	ફ	યા	ર	લ	ય	ગુ	ર	પ	ટી	દૂ	ષિ	ન
નિ	દ	કિ	ત્ની	ફ	બ	દૂ	ષિ	ત	પો	ત્ની	હ	ફ	ય



રીંગ માં

આ અઠવાડિયે તમારા હૃદયનું ધ્યાન રાખો. જો તમારી વિરુદ્ધ કંઈક કરવામાં આવ્યું હોય, તો
યાદ રાખો કે પાપ તેઓ કરે છે, તમે નહીં. દરરોજ પ્રાર્થનામાં કહો, “હું તમારી સમક્ષ શુદ્ધ છું,
ભગવાન”. જો તમે બીજા કોઈની વિરુદ્ધ કંઈક કર્યું હોય, તો તે વ્યક્તિ અને ભગવાનની માફી
માંગવી. પછી તમે પ્રાર્થના કરતાં રહી શકો છો, “હું તમારી સમક્ષ શુદ્ધ છું, ભગવાન.”

પાપોને જીતી લો...



...જ્યારે તમે
હજી પણ
કરી શકો!

"પણ ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે! કારણ, આપણે જ્યારે પાપી હતા, ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા." રોમનોને પત્ર 5:8 "પણ જો ઈશ્વર સમક્ષ આપણે આપણાં પાપ કબૂલ કરીએ તો તે આપણાં પાપની ક્ષમા આપણે અને આપણને બધાં દુષ્કર્મોથી શુદ્ધ કરશે, કારણ, તે વિશ્વાસુ તથા ન્યાયી છે." યોહાનનો પહેલો પત્ર 1:9 " હું જન્મથી જ પાપી છું; બલ્કે, મારી માતાના ઉદરે ગર્ભ રહ્યો તે પળથી જ હું પાપી છું." ગીતશાસ્ત્ર 51:5

Champions 2 Difficult
Gujarati



20131

www.ChildrenAreImportant.com
info@childrenareimportant.com
We are located in Mexico.
DK Editorial Pro-Visión A.C.

 Equip & Grow
બાળકો મહત્કપૂણ છે